



NAVSARI AGRICULTURAL UNIVERSITY



भारतीय
ICAR

દાખોટામાં મુલ્યવદ્ધની



કૃષિ વિશ્વાસ કેન્દ્ર

નવસારી કૃષિ યુનિવર્સિટી

અઠવા ફાર્મ, સુરત - ૩૬૪ ૦૦૭

ફોન નં. ૦૨૬૯૧-૨૬૫૫૫૫૫૫

પ્રકાશન નં. ૧૧૬/૨૦૧૮-૨૦૧૯

વર્ષ : ૨૦૧૮-૨૦૧૯

ટામેટામાં મુલ્યવર્ધન

પ્રો. ગીતા જે. બીમાણી, વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન)
ડૉ. જે. એચ. રાઠોડ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કે.વિ.કે. સુરત

શાકભાજુ માર્કેટમાં વિવિધ જાતના શાકભાજુમાં લાલ રંગના ટામેટા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય છે અને પોત-પોતાની રીતે આગાવા ગુણધર્મો અને મહત્વ હોવા છતાં એક બાબતમાં તેઓ સૌ એક સમાન છે અને તે છે તેમની સંખ્યા શક્તિ, મોટા ભાગનાં ફળો અને શાકભાજુ જીવિત કોષોથી ભરપૂર હોય છે. તેથી લાંબા સમયે ભૌતિક અને રાસાયણિક પરિવર્તનને કારણે બગાડ થાય છે. આથી જો તેના પર કોઈ ખાસ પ્રક્રિયા કરવામાં ના આવે તો થોડા સમયમાં બગાડી લાય છે. અને અંતે ફેકી દેવા પડે છે. આ બાબતે ભારત સરકારનાં એક અહેવાલ મુજબ ફળ અને શાકભાજુનાં કુલ ઉત્પાદનના ૨૫% જેટલો બગાડ થાય છે. જેની કિંમત કરોડો ઇપ્પિયામાં અંદાજવામાં આવેલ છે. ભારત જેવા વિકાસશીલ દેશને આવો બગાડ પોષાય નહીં અને આર્થિક રીતે પણ પરવઢે નહીં.

આપણે જાણીએ છીએ કે શિયાળામાં મોટા ભાગો ટામેટાં તાજા, લાલ ચમકદાર અને ઘણી મોટી સંખ્યામાં મળી રહે છે. તેમજ શિયાળામાં સરતા પણ મળે છે. જ્યારે તેની અતુલ સ્વભાવ મેળવવા ખૂબ મુશ્કેલ બને છે. અને જે મળે છે, તે ખૂબ મોંઘા મળતા હોવાથી તેને ખરીદીને આહારમાં લઈ શકતા નથી. આ ઉપરાંત ટામેટા વિટામીન અને ખનીજ દ્વારાથી ભરપૂર હોય છે. આથી તે આરોગ્યવર્ધક અને સ્વાસ્થ્ય હોય છે. માટે ટામેટા તેની અતુલમાં સરતા મળે ત્યારે તેનો ઉપયોગ રાસાયણિક પરિકણણ દ્વારા આખા વર્ષ માટે સંગ્રહી લઈએ તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ શકાય.

બદલાયેલ જીવન પ્રણાલી અને ફાસ્ટ કૂડના આ જમાનામાં આપણા રોજગરોજના આપણા આહારમાં તેમજ પ્રસંગોપાત ટામેટા ની વિવિધ બનાવટો જેવીકે ટોમેટા સોસ, ચાટની, કેચપ વગેરેનો ઉપયોગ વધતો લાય છે. બજારમાં કિસાન અને મેળી ખ્રાંડ ટોમેટો કેચપ ધૂમ મયાવે છે. પરંતુ ધાણા ફુટુંબો આર્થિક કટોકટીને કારણે તેને વેચાતો લઈને આહારમાં સમાવેશ કરી શકતા નથી.

(૧) ટામેટો કેચપ :-
બનાવવાની રીત:-

અ.નં.	સામગ્રી	પ્રમાણ	અ.નં.	સામગ્રી	પ્રમાણ
૧	ટામેટા	૫ કિલો	૫	આદુ	૫૦ ગ્રામ
૨	લસણા	૧૫ ગ્રામ	૬	તજ, લવિંગ	૫ ગ્રામ
૩	ખાંડ	૫૦૦ ગ્રામ	૭	સફેદ, મરી	૧૦ ગ્રામ
૪	સોડિયમ બેન્જોએટ	૪ ગ્રામ	૮	વિનેગાર (સરકો)	૨૦ ગ્રામ

તાજા પાકા અને મોટા લાલ રંગના ટામેટા પસંદ કરવા. આ ટામેટાને સ્વરદ્ધ પાણીથી ધોઈ નાના ટુકડા કરી ૧૫ થી ૨૦ મિનિટ ગરમ કરવા અથવા પ્રેશર ફુકરમાં બાફો. જેથી તેની છાલ નરમ બની જશે. ત્યારબાદ આ ટુકડાને કિયન માસ્ટરમાં અથવા મિક્સરમાં પીસીને રસ તૈયાર કરો. આ રસ ને ચારણી અથવા આછા કપડા થી ગાળી ને બીજ તથા છાલ દુર કરવા. ત્યારબાદ આ રસમાં શ્રીજા ભાગની ખાંડ ઉમેરી રસ ફૂલીથી ગરમ કરવા માટે મુકો. તજ,

લવિંગ અને મરીનો બારીક ભૂકો કરી ગીણા કપડામાં ટીલી પોટલી બાધી રસમાં મૂકો. તેમજ કાંદા, લસણ, આદુને પણ પીસીને તેની બીજી કપડામાં ટીલી પોટલી બાધી તેને પણ રસમાં નાખો. રસ ઘણું થાય એટલે તેમાં બે બાગની ખાંડ ઉમેરી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી રસને ઉકાળો. ત્યારબાદ રસ બરાબર ઘણું થઈ જાય એટલે ગરમી પરથી ઉતારી મસાલાની પોટલી બહાર કાઢી લેવી અને તેમાં સ્વાદ મુજબ લાલ મરચું અને મીહું ઉમેરી હલાવવું. છેલ્લે તેમાં સંગ્રહક તરીકે એસિટિક એસિડ અને સોડિયમ બેન્જોએટ સહેજ પાણીમાં ઓગાળી ઉમેરવો. કેચપને જીવાણું રહિત કરેલી બોટલમાં ભરી હંડી બેજરહિત જગ્યાએ સંગ્રહ કરવો.

(૨) ટામેટાની ચાણી

બનાવવાની રીત:-

આંબલીનું પાણી બનાવી રાખવું. બધો જ મસાલો ખાંડીને ભૂકો કરવો. ટામેટા, આદુ, કાંદા, લસણ વગેરેના ટુકડા કરી ગરમ કરવા. બરાબર ઘણું થઈ જાય એટલે ખાંડ ઉમેરવી. થોડીવાર ગરમ કરવું. હંડુ પડે એટલે ગરમ મસાલાનો ભૂકો, લાલ મરચું, મીહું, એસિટિક એસિડ, આંબલીનું પાણી ગરણી વડે ગાળી ઉમેરવું. બરાબર મિશ્ર કરી બરણીમાં ભરી લેવું.

અ.નં.	સામગ્રી	પ્રમાણ	અ.નં.	સામગ્રી	પ્રમાણ
૧	ટામેટા	૨ કિલો	૭	આદુ	૫૦ ગ્રામ
૨	કાંદા	૨૦૦ ગ્રામ	૮	લજ લવિંગ	૫ ગ્રામ
૩	લસણ	૧૦૦ ગ્રામ	૯	મરી, જીજ	૧૦ ગ્રામ
૪	મીહું	૫૦ ગ્રામ	૧૦	આંબલી	૩૦ ગ્રામ
૫	ખાંડ	૫૦૦ ગ્રામ	૧૧	એસિટિક એસિડ	૨૦ ગ્રામ
૬	લાલ મરચું	૩૦ ગ્રામ			

(૩) ટામેટાની રસની જાળવણી

બનાવવાની રીત:-

પાકા લાલ રંગના ટામેટા લઈ ચોખાના પાણીથી ધોઈ ટુકડા કરવા. લીલો ભાગ છોચ તો કાઢી નાખવો. સ્ટેઇનલેસ સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો. ટુકડાને ગરમ કરવા. મિશ્રણ એકરસ થઈ જાય, ઉકળો અને ટુકડા એકરસ મુલાયમ થઈ જાય એટલે કિંચન માસ્ટરમાં પસાર કરી રસ તૈયાર કરવો. ત્યારબાદ રસને ઉકાળવો. ઘણું બનાવવો. ગરમી આપવાનું બંધ કર્યા બાદ ૫ થી ૧૦ મિનીટ પછી ૧ કિલોગ્રામ રસ દીઠ ૧૦ ગ્રામ ખાંડ, ૫ ગ્રામ મીહું, ૧ ગ્રામ એટલે ૭ મીલી એસિટિક એસિડ ઉમેરીને સ્ટર્ટીલાઇઝ કરી બોટલમાં ભરો. ૧ હંદુ જેટલો રસ બેસી જ્ઞે તેટલું વોલ્યુમ થશે. જેના કારણે રસ લાંબો સમય રાખી શકાય.

અ.નં.	સામગ્રી	પ્રમાણ	અ.નં.	સામગ્રી	પ્રમાણ
૧	ટામેટા	૨ કિલો	૪	ખાંડ	૪૦ ગ્રામ
૨	મીહું	૨૦ ગ્રામ	૫	સોડિયમ બેન્જોએટ	૩ ગ્રામ
૩	એસિટિક એસિડ	૨૦ ગ્રામ			

(૪) ટામેટાની મિશ્ર શાકભાજુ સાયેનો સોસ

બનાવવાની રીત:-

ટામેટા, ગાજર, સાફેદ કોળુ, આદુ વગેરે સાફ કરી ટુકડા કરવા. પ્રેસર ફૂકરમાં એક ખાલો પાણી રેડી, ટુકડા ઉમેરવા. એક સીટી વગાડીને ટુકડાને બાફી નાખવા. ત્યારબાદ કિંચન માસ્ટરમાં પસાર કરી રસ તૈયાર કરવો. ખાંડ ઉમેરી ગરમ કરવું. બરાબર ઘણું થાય એટલે હંડુ પાડવું. ત્યારબાદ લાલ મરચું, મસાલાનો બારીક ભૂકો, ટામેટાનો ખાદ્ય રૂંગ, સોડિયમ બેન્જોએટ અને એસિટિક એસિડ ઉમેરી બરાબર મિશ્ર કરી બોટલમાં ભરી દેવું.

અ.નં.	સામગ્રી	પ્રમાણ	અ.નં.	સામગ્રી	પ્રમાણ
૧	ટામેટા	૨ કિલો	૮	ખાંડ	૧ કિલો
૨	બટાટા	૨૫૦ ગ્રામ	૧૦	મરી, જુર	૧૦ ગ્રામ
૩	સકરજન	૫૦૦ ગ્રામ	૧૧	મીઠુ	૫૦ ગ્રામ
૪	શક્કરીયા	૧૦૦ ગ્રામ	૧૨	લાલ મરચું	૩૦ ગ્રામ
૫	તાજ લવિંગ	૫ ગ્રામ	૧૩	ઓસિટિક એસિડ	૨૫ મીલી
૬	આદુ	૧૦૦ ગ્રામ	૧૪	સોડિયમ બેન્જોએટ	૫ ગ્રામ
૭	ગાજર	૨૫૦ ગ્રામ	૧૫	ખાદ રેંગ	૧.૫ ગ્રામ
૮	સફેદ કોળું	૫૦૦ ગ્રામ			

(૫) ટામેટાનો સુપ:

બનાવવાની રીત :

તાજા, પાકા, સારા ટામેટા પસંદ કરી, સ્વરષ્ટ પાણીથી ધોઈ નાના ટૂકડાં કરી ૧૦ થી ૧૫ મીનીટ ગરમ કરવા. ટૂકડા ગરમ થતાં મુલાયમ થશે એટલે મિન્ક્યાર કે કિચન માસ્ટરમાં પસાર કરી રસ કાઢી લેવો. આ રસમાં ટામેટા કેચપની જેમજ જ્રાણ અલગ અલગ પોટલીઓ તૈયાર કરી ખાંડ નાંખી આશરે ૧૫ થી ૨૦ મીનીટ રસ ઉકાળવો. જેથી મસાલો રસમાં સારી રીતે ભળી જાય. દરમાન આરાઝનો લોટ થોડા ટામેટાનાં રસમાં અલગ વાટકીમાં લઈ ઓગાળી તૈયાર થયેલ રસમાં બેળવી દેવો. ત્યારબાદ ગરમી ઉપરથી ઉતારી મીઠું કે મરચું, કીમ અથવા બટર બેળવીને ઉપયોગ કરવો.

અ.નં.	સામગ્રી	પ્રમાણ	અ.નં.	સામગ્રી	પ્રમાણ
૧	ટામેટા	૨ કિલો	૫	કીમ અથવા બટર	૨૦ ગ્રામ
૨	કાંદા	૨૫ ગ્રામ	૬	આરાઝનો લોટ	૧૦ ગ્રામ
૩	ગરમ મસાલો	૫ ગ્રામ	૭	ખાંડ	૧૨૫ ગ્રામ
૪	મરચાની ભૂકી	૩ ગ્રામ	૮	મીઠુ	૧૫ ગ્રામ

(૬) ટામેટાની વેફર્સ:-

બનાવવાની રીત:-

સૌ પ્રથમ ટામેટાને ધોઈને બાફી નાખો. ત્યારબાદ કશ કરીને ખુરી કરો. સાખુદાણાને ૮ થી ૧૦ કલાક જરૂર પૂરતા પાણીમાં બોળી રાખવા ત્યારબાદ સાખુદાણાને આખા રહે એ રીતે થોડો સમય બાફ્ફવા. હવે બાફ્ફેલા સાખુદાણામાં ટામેટાની તૈયાર કરેલ ખુરી મિક્સ કરીને તેમાં વાટેલા લીલા મરચા, અધકચારું ખાંડું જુરું, મીઠું વગેરે ઉમેરીને બરચાબર મિક્સ કરો. પ્લાસ્ટિકની શીટ પર ચમગી વડે ગોળ ચકરડા પાડીને તેને સૂર્યોપ્રકાશમાં બે દિવસ સુકવવા મૂકો. ૧૦% થી ઓછો ભેજ રહે એટલે સ્વરષ્ટ બરણીમાં ભરીને મૂકી રાખો. જરૂર મુજબ તળીને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો.

અ.નં.	સામગ્રી	પ્રમાણ	અ.નં.	સામગ્રી	પ્રમાણ
૧	ટામેટા	૧ કિલો	૪	મીઠુ	પ્રમાણસર
૨	સાખુદાણા	૧કિલો	૫	જુરું	૫ ગ્રામ
૩	લીલા મરચા	સ્વાદ મુજબ			